

આઈઆઈટીના કલ્ચરલ ફેસ્ટમાં અનેક સ્પર્ધાઓ યોજાઈ



આઈઆઈટી-ગાંધીનગર દ્વારા બે દિવસના કલ્ચરલ ફેસ્ટ 'બ્લિથકોન 2016' નું આયોજન 30-31 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલાં દિવસે સોલો સિંગિંગ, સ્ટ્રીટ પ્લે સ્પર્ધા, જોબલેસ: મોક ઇન્ટરવ્યુ સ્પર્ધા, મીસ્ટર એન્ડ મિસ બ્લિથકોન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. સોલો સિંગિંગ સ્પર્ધામાં વિજેતા બનેલાં વિદ્યાર્થીને 94.3 માય એફએમ પર લાઈવ પર્ફોમન્સનો મોકો મળશે. આ ઉપરાંત બીજા દિવસે પનારો: ફેશન શો, ધ બટલર ડિડ ઇટ - એ ક્રાઈમ મિસ્ટ્રી ઇન્વેસ્ટિગેશન ગેમ, સિન્કોનાઈઝ- ધ ગ્રુપ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.